



વેકેશનની મજા પિયરમાં જીતો... મન...!

ધી મે ધીમે ગરમી વધી રહી છે. લગભગ બધાંની પરીક્ષાઓ પતવા આવી છે. બસ... હવે વેકેશન...વેકેશન એટલે આજે રજા... કાલે રજા...

મોજમજા... મોજમજા...! નો રૂટિન, નો ટયુશનકલાસ, નો સ્કૂલ એન્ડ નો ટેન્શન..... વેકેશન પડતાં જ બાળકો અને મમ્મીઓ જે હાશકારો અનુભવે છે એ આખા વર્ષ દરમ્યાન રહે એવી શુભેચ્છાઓ....! કારણ કે વેકેશન આ બંને માટે પડકાર છે. એક મિનિટની નવરાશ ન મળે એવા ટાઈટ શિડયુલમાંથી સાવ નવરાધૂપ બન્યા પછી ખાલી સમયને કંઈ રીતે હેન્ડલ કરવો એ મોટો પ્રશ્ન છે.

ચીન્ટુ અને મોન્ટુને પૂછ્યું તમને સમર કેમ્પમાં દાખલ કરીએ જેથી નવું નવું શીખવા મળે અને બધાં છોકરાંઓ જોડે આનંદ મળે પણ તેઓએ ઘસીને ના પાડી અને કહ્યું અમારે તો મામાને ઘેર જવું છે. આમ પણ મોટા ભાગની ભારતીય યુવતીઓ ઉનાળાના વેકેશનમાં અર્થાત્ રજાઓમાં પોતાના પિયર જતી હોય છે. બાળકોને રિલેક્સ થવા અને વેકેશન ગાળવા તેમ જ પોતાનાં મા-બાપ, ભાઈ-ભાભીને મળવા, તેમની સાથે થોડા દિવસો પસાર કરવા માટે તેઓ પોતાના પિયર જતાં હોય છે પરંતુ ત્યાં જવાનો પ્લાન બનાવવાની સાથે જ મનમાં ઘર કરી ગયેલી કેટલીક વાતો પણ મગજમાં ફડફડવા લાગે છે. ગયા વર્ષે કે છેલ્લે જ્યારે પિયર ગયાં હોય ત્યારની ભાભી સાથેની બોલચાલની યાદો મનમાં હજુય તાજી હશે પરંતુ મનને ખાટું કરનારી એ વાતોને વિચારીને ભૂલી જવામાં ભલાઈ છે. સારું તો એ છે કે મીઠાશ ભરનારી વાતોને વિચારીને હસી-પુશીથી રહેવાય અને સંબંધોની નૌકાને સમજદારી અને પ્યારના હલેસાથી પાર લગાવી શકાય. યાસીએ એ રીતે મનને તૈયાર કરી દીધું.

ચીન્ટુ અને મોન્ટુને કહ્યું આપણે મામાને ત્યાં જઈએ છીએ. પણ ત્યાં મામાના છોકરા સોનુ અને ગોલુ સાથે જરા પણ મારામારી, લડાલડી કરવાની નહીં. આપણે પણ ખૂબ બધી ગેમ લઈશું, તેમની ગેમ અને આપણી ગેમ હળીમળીને રમવાનું. આપણે નાના-નાની, મામા-મામી, સોનુ-ગોલુ માટે કંઈ ને કંઈ નાનીમોટી ગિફ્ટ પણ લઈ જઈશું જેથી સૌ ખુશ થાય. બધી તૈયારીઓ થઈ ગઈ અને સૌ પહોંચ્યાં મામાને ત્યાં... સૌએ ભાવપૂર્ણ આવકાર આપી નવાજયા. ચીન્ટુ-મોન્ટુ અને તેની મમ્મી યાસી સૌ વડીલોને પગે લાગ્યાં. બંને પરિવાર એકબીજાને ભેટયાં. ભણતરની, રીઝલ્ટની વાત કરી ત્યાં તો મોન્ટુ બોલી ઊઠ્યો, “ગોલુ- સોનુ અમે તમારા સૌ

માટે ગિફ્ટ અને જાતજાતની ગેમ લાવ્યાં છીએ. યાસીએ સૌને પ્રેમથી ગિફ્ટ આપી. યાસીએ ભાભીને ગિફ્ટ આપતાં કહ્યું આમાં સરસ મજાના બેંગલ્સ અને ડિઝાઈનર ચાંદલા છે. ભાઈ માટે સેન્ટ અને બેલ્ટ છે. મમ્મી માટે સરસ મજાની સાડી લાવી છું અને પપ્પા તમારા માટે લો આ શાલ...!

થોડી વાર વાતચીત ચાલી પછી યાસી એકદમ ભાભીને કહેવા લાગી, “ભાભી રસોઈ તો તૈયાર છે ને? અમે આવવાના છીએ એ ખબર છે છતાં તમને એમ કે નણંદબા આવીને છો કરતાં, અમારે તો સાસરામાં પણ કરવાનું ને પિયરમાં પણ કરવાનું. બે ઘડી બેસવાનું નહીં.” ભાભીએ કહ્યું, “યાસીબેન બધું તૈયાર છે. ઊતરતી રોટલીઓ બધાંને બેસાડી



પિયર જવાનો પ્લાન બનાવવાની સાથે જ મનમાં ઘર કરી ગયેલી કેટલીક વાતો પણ મગજમાં ફડફડવા લાગે છે. ગયા વર્ષે કે છેલ્લે જ્યારે પિયર ગયાં હોય ત્યારની ભાભી સાથેની બોલચાલની યાદો મનમાં હજુય તાજી હશે પરંતુ મનને ખાટું કરનારી એ વાતોને વિચારીને ભૂલી જવામાં ભલાઈ છે. સારું તો એ છે કે મીઠાશ ભરનારી વાતોને વિચારીને હસી-પુશીથી રહેવાય અને સંબંધોની નૌકાને સમજદારી અને પ્યારના હલેસાથી પાર લગાવી શકાય.

દઈશું. અકળાવ નહીં. ઘરમાં બધાં ભેગાં થયાં હોય ત્યારે થોડું મોડું-વહેલું પણ થાય.” યાસીનાં મમ્મીએ યાસીને કહ્યું, “તું રોટલી કરાવવામાં મદદ કર. ભાભીને હેલ્પફુલ બન, ભાભીને શિરે પણ કેટલી જવાબદારીઓ હોય છે. આટલાં બધાંની ખાવા-પીવાની વ્યવસ્થા કરવાની હોય તો તારે સામેથી ભાભીને કહેવાનું હોય કે ચાલો ભાભી શું કામ છે? એમ હુકમ કરવાથી એકબીજાનાં મન ન જીતાય.”

ભાઈનાં બાળકો સોનુ અને ગોલુ ફોઈ ફોઈ કરતાં કેટલી વાર પાસે આવ્યાં પણ યાસી તો બાળકોને વ્હાલ કરવાને બદલે દૂર કરતી જાય એ બરાબર નથી. બાળકો પ્યારના ભૂખ્યાં છે. ભત્રીજો -ભત્રીજી આપને બેહદ પ્યાર કરે છે અને તમે પણ તેમના પર એટલો જ પ્યાર રાખો. ઘરમાં બાળકો એકદમ ધીંગામસ્તી કરવા લાગ્યાં, ખૂબ જ કલબલાટ કરવા લાગ્યાં તો નાનીમા બૂમો મારવા લાગ્યાં. યાસી આ છોકરાઓને તો સાચવ. ત્યારે યાસી સૌને બેસાડીને ગેમ રમાડવા લાગી. ગેમ રમતાં રમતાં યાસી છોકરાઓને પટાવવા લાગી. ગેમ સારી રીતે રમશો તો તમારે માટે પાસ્તા -પોપકોર્ન બનાવીશ. સૌ ખુશ થઈ ગયાં. ખાતાં ખાતાં છોકરાઓ કહેવા લાગ્યાં, “બુઆ કાલે ગાર્ડનમાં અને અને વોટરપાર્કમાં જઈશું, લઈ જશો ને? યાસીએ ભાઈ-ભાભી સાથે નક્કી કર્યું અને બીજે દિવસે ચીન્ટુ-મોન્ટુ-ગોલુ-સોનુને તો ખુશીનો પાર ન હતો. સૌ સાથે રમ્યાં અને ઝથડા પણ કર્યાં. છોકરાઓની લડાઈમાં મોટાં પણ લડ્યાં. યાસી તે વખતે ચૂપ રહી. મનથી વિચારવા લાગી, પિયરમાં બધાં સાથે મારે શું કામ બગાડવું? ભાભી, જુઓને આ છોકરાંઓ તો પાછા એક થઈને રમવા લાગ્યા. આપણે મોટાઓએ સમજવાનું છે. આપણે એકબીજાનાં મન જીતવાનાં છે. નણંદ-ભોજાઈ એકબીજાને ભેટ્યાં અને સૌ માટે ભોજનનો ઓર્ડર કર્યો. બધાંએ આનંદથી ખાધું-પીધું ને મામાને ત્યાં મજા કરી.

તો વાયકમિત્રો...! પિયરમાં જાવ તો સૌના જીતો મન, એ રીતે વર્તન કરો. હસતાં રહો, સૌને ગમતાં રહો. વાતે વાતે ખોટું લગાડીને મોઢું નહીં ચઢાવો. વેકેશનમાં તમે મામાને ત્યાં આનંદ કરવા ગયા છો તો સૌની સાથે એકમેક થઈ સંવાદિતા જાળવો. બધાંને ખાવામાં રસ હોય છે. ક્યારેક તમે પણ ઈવનિંગ સ્નેક્સ માટે બહારથી કંઈક પૌષ્ટિક નાસ્તો મંગાવો અને ગરમા-ગરમ ચાની સાથે આખા પિયરને સર્વ કરો. તમારાં મમ્મીપપ્પાને પણ ગમશે. ભાઈને નાજ થશે અને ભાભી તો જાન લૂંટાવી દેશે. આમ કરવાથી પિયર પરિવારમાં આપનું નામ સરનેહ લેવાશે ને પિયરમાં તમે સૌના માનઆદરના પાત્ર બની રહેશો.

સુવર્ણરજ

વેકેશન એ મજાની સાથે ટ્રેનિંગ સમય છે. સ્કૂલ-ટયુશનના ચક્કરમાં તમે બાળકોને જે નથી શીખવી શકતાં એ શીખવો. તો સજ્જારીઓ, યા હોમ કરીને પડો વેકેશન હે આગે.....